

ગુજરાત કેન્સર અને રીસર્ચ ઇન્સ્ટિટ્યુટ

તપાસ -સારવારમાં રાહત/ માફી માટેની વિવિધ યોજનાઓની માહિતી *

માહિતીની જાણકારી માટે સંપર્ક : પૂછપરછ કેન્દ્ર 15 - A (નવા કેસ વિભાગ)

- (૧) **મુખ્યમંત્રી અમૃતમ યોજના(MA YOJANA):** મુખ્યમંત્રી અમૃતમ યોજના (MA YOJANA)ના કાર્ડધારક તથા તે કાર્ડમાં સમાવિષ્ટ કુટુંબનાં સભ્યો (5 વ્યક્તિઓ)ને અત્રેની હોસ્પિટલમાં આ યોજના અંતર્ગત કેન્સર માટેની નિયત કરેલ તપાસ-સારવારમાં વાર્ષિક ત્રણ લાખ રૂપિયા (રૂ.૩,૦૦,૦૦૦) સુધીની માફી આપવામાં આવે છે.
- (૨) **મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજના(MA VATSALYA YOJANA):** મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજના (MA VATSALYA YOJANA) કાર્ડધારક તથા તે કાર્ડમાં સમાવિષ્ટ કુટુંબના સભ્યો (5 વ્યક્તિઓ)ને અત્રેની હોસ્પિટલમાં આ યોજના અંતર્ગત કેન્સર માટેની નિયત કરેલ તપાસ-સારવારમાં વાર્ષિક ત્રણ લાખ રૂપિયા (રૂ.૩,૦૦,૦૦૦) સુધીની માફી આપવામાં આવે છે.
- (૩) **અનુસૂચિત જાતિ (SCHEDULED CASTE):** અનુ.જાતિ (SC) ના દર્દીઓએ જાતિનું પ્રમાણપત્ર સમાજ કલ્યાણ અધિકારી/મામલતદાર/ટી.ડી.ઓ.નું તથા આવકનું પ્રમાણપત્ર (રૂ.૧,૫૦,૦૦૦ સુધીની વાર્ષિક આવકમાં ૧૦૦% તથા રૂ ૧,૫૦,૦૦૦થી ઉપર ની વાર્ષિક આવકમાં ૫૦% રાહત માટે) મામલતદાર/ટી.ડી.ઓ./કલેક્ટર ઓફીસના સક્ષમ અધિકારીનું રજુ કરવું. આ સાથે રહેણાંકનાં પૂરાવા રજૂ કરવાનાં રહેશે (રેશનકાર્ડ, ઇલેક્શન કાર્ડ, આધાર કાર્ડ, લાઇટબીલ વગેરે)
- (૪) **અનુસૂચિત જનજાતિ (SCHEDULED TRIBE):** અનુ.જનજાતિ (ST)ના દર્દી ઓએ જાતિનું પ્રમાણપત્ર સમાજ કલ્યાણ અધિકારી/મામલતદાર /ટી.ડી.ઓ.નું તથા આવક નું પ્રમાણપત્ર/મામલતદાર/ટી.ડી.ઓ./કલેક્ટર ઓફીસ ના સક્ષમ અધિકારીનું રજૂ કરવું. આ સાથે રહેણાંકનાં પૂરાવા રજૂ કરવાનાં રહેશે (રેશનકાર્ડ ,ઇલેક્શન કાર્ડ, આધાર કાર્ડ, લાઇટબીલ વગેરે)
- (૫) **શાળા આરોગ્ય કાર્યક્રમ(SCHOOL HEALTH PROGRAMME):** સ્કુલ હેલ્થ પ્રોગ્રામ હેઠળ રાહત મેળવવા સ્કુલ હેલ્થ પ્રોગ્રામ રાહત/માફીનો પત્ર અન્ય પુરાવા સાથે રજૂ કરવાનાં રહેશે.
- (૬) **એલ.આઇ.જી. 50% રાહત (LIG 50% free)** કુટુંબની વાર્ષિક આવક બે લાખ રૂપિયા (રૂ ૨,૦૦,૦૦૦) સુધીની હોય તેવા દર્દી ઓને મામલતદાર/તાલુકા વિકાસ અધિકારી/કલેક્ટર ઓફીસના સક્ષમ અધિકારીનો આવકનો દાખલો તથા હોસ્પિટલના નમુના પ્રમાણેનું એફિડેવિટ અને રહેણાંકનાં પૂરાવા રજુ કર્યા બાદ સારવારમાં ૫૦% રાહત આપવામાં આવે છે.
- (૭) **ઇન્ડિયન કેન્સર સોસાયટી (INDIAN CANCER SOCIETY-ICS)** મટી શકે તેવા કેન્સરના દર્દી ઓ જેના કુટુંબની વાર્ષિક આવક ચાર લાખ રૂપિયા (રૂ.૪,૦૦,૦૦૦) સુધીની હોય તેને ઇન્ડિયન કેન્સર સોસાયટી,મુંબઇ તરફથી રૂ. ૫ લાખ (રૂ.૫,૦૦,૦૦૦/-) સુધીની તપાસ -સારવારમાં રાહત/માફી તેમજ બોનમેરો ટ્રાન્સપ્લાન્ટેશન માટે રૂ. ૮ લાખ (રૂ.૮,૦૦,૦૦૦/-) સુધીની રાહત મળી શકે તેમ છે. તે માટે આપને સારવાર આપતા ડોક્ટરશ્રીનો સંપર્ક કરવો.
- (૮) **ઇ.એસ.આઇ.એસ.(E.S.I.S.):** ઇ.એસ.આઇ.એસ ના દર્દીઓએ સારવાર માટે રીફર ફોર્મ(Non EXIT)/લાયઝન ઓફિસર (રૂમ નં.-૭૦) સિવિલ હોસ્પિટલ ઓ.પી.ડી.માંથી રીફર કરેલ કેસ રજુ કરવા.
- (૯) **કેદી (PRISONER):** કેદી દર્દીએ સાથે જેલ સુપ્રિટેન્ડેન્ટનો સારવાર માટેનો ભલામણ પત્ર લાવવો જરૂરી છે .
- (૧૦) **ગરીબ દર્દી સહાય(POOR PATIENT'S ASSISTANCE):** ઉપર્યુક્તમાંથી કોઇપણ યોજના હેઠળ મફત સારવાર/સહાય મળવાપાત્ર ન હોય અને દર્દી ને સહાયની જરૂરિયાત હોય તો પ્રધાનમંત્રી /કેન્દ્રિય આરોગ્ય મંત્રી સહાય યોજનામાં અરજી કરવી અથવા ગરીબ દર્દી સહાય કેન્દ્ર રૂમ નં ૬૮માં મળવું.
- (૧૧) **કંડલા પોર્ટ ટ્રસ્ટ, ઇસરો, રેલ્વે, ઓ.એન.જી.સી.** વગેરે જેના પોસ્ટ પેઇડ ની મંજૂરી હોય તેવા કર્મચારીઓએ જરૂરી રીફર ફોર્મ તથા પ્રમાણપત્ર સાથે એકાઉન્ટ ઓફિસમાં મળવું.
- (૧૨) નવા કેસના પ્રથમ દિવસે માફીની જરૂરિયાતવાળા દર્દીઓએ તેઓની તપાસ-સારવાર-દવામાં માફી માટે તેઓનાં યુનિટના વડા ડોક્ટરશ્રીની કેસમાં ભલામણ લખાવીને નિયામકશ્રીની સેક્રેટરીયલ ઓફીસમાં જવું. જેથી જરૂરિયાત પ્રમાણે યોગ્ય માફી કરવામા આવશે ત્યારબાદ અન્ય લાગુ પડતી માફી- રાહતની જરૂરી કાર્યવાહી અનુસરવાની રહેશે.
- (૧૩) **રાષ્ટ્રીય આરોગ્ય નિધિ RASHTRIYA AROGYA NIDHI (RAN):** રાષ્ટ્રીય આરોગ્ય નિધિમાં બીપીએલ કાર્ડધારક તથા તે કાર્ડમાં સમાવિષ્ટ કુટુંબના સભ્યોને અત્રેની હોસ્પિટલમાં બે લાખ રૂપિયા (રૂ ૨,૦૦,૦૦૦) સુધીની માફી આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય નવી દિલ્હી તરફથી આપવામાં આવે છે.આ સાથે બીપીએલ કાર્ડ, ચૂંટણી કાર્ડ/આધાર કાર્ડ તેમ જ મામલતદાર/ટી.ડી.ઓ./કલેક્ટર ઓફીસ દ્વારા પ્રમાણિત આવકનું પ્રમાણપત્ર જરૂરી છે. તે માટે આપને સારવાર આપતા ડોક્ટરશ્રીનો સંપર્ક કરવો.
- * તપાસ-સારવારમાં રાહત/માફી માટેની વિવિધ યોજનાઓમાં સરકારશ્રી/સંસ્થા દ્વારા વખતોવખત લાગુ પડતાં ઠરાવો/પરિપત્રો અને નિયમોની જોગવાઈ મુજબ થતાં સુધારા-વધારાને માન્ય ગણવાનાં રહેશે.